## ELECTROTHERM® (INDIA) LTD.





Ref. No.: EIL/SD/38<sup>th</sup> AGM - NA/2024-2025/2108

Date: 21st August, 2024

To, To,

General Manager (Listing) Listing Department

BSE Ltd. National Stock Exchange of India Ltd.

Phiroze Jeejeebhoy Towers, Exchange Plaza, Bandra – Kurla Complex,

Dalal Street, Fort, Mumbai – 400 001 Bandra (East), Mumbai – 400 051 COMPANY CODE: 526608 COMPANY CODE: ELECTHERM

Dear Sir/Madam,

Sub: Newspaper Advertisement - Notice of 38th Annual General Meeting

Please find enclosed herewith copies of the newspaper advertisement published in Financial Express on 21<sup>st</sup> August, 2024 in English & Gujarati Language, in compliance with the provisions of the Companies Act, 2013, inter alia, informing the shareholders about the 38<sup>th</sup> Annual General Meeting and E-Voting information.

You are requested to please take the same on your record.

Thanking you,

Yours faithfully,

For Electrotherm (India) Limited

Fageshkumar R. Soni Company Secretary & Compliance Officer Membership No.: F8218

Encl: As above

**ELECTROTHERM (India) Limited** 

**HEAD OFFICE & WORKS:** 

Survey No. 72, Palodia, (Via Thaltej, Ahmedabad), Gujarat-382115, India.

Phone: +91-2717-234553 – 7, 660550Fax: +91-2717-234866 Email: ho@electrotherm.com | Website: www.electrotherm.com REGD. OFFICE:

A-1, Skylark Apartment, Satellite Road, Satellite, Ahmedabad-380015. Phone: +91-79-26768844, Fax: +91-79-26768855

CIN: L29249GJ1986PLC009126 Email: sec@electrotherm.com Place: Gujarat

Dated: 21-08-2024

GRIHUM HOUSING FINANCE LIMITED
(Formerly known as Poonawalla Housing Finance Ltd.),
Registered Office: 602, 6th Floor, Zero One IT Park, Sr. No.79/1, Ghorpadi, Mundhwa Road, Pune-411036.

DEMAND NOTICE
Under Section 13(2) of
The SARFAESI Act 2002 You the below mentioned Borrowers/ Co-Borrowers/ Guarantors have availed Home loans/ Loans against property facility (ies) by mortgaging your immov able property/ies from Grihum Housing Finance Limited (formerly known as Poonawalla Housing Finance Limited as the name Poonawalla Housing Finance Limited changed to Grihum Housing Finance Limited With effect from 17 Nov 2023 (Previously Known as Magma Housing Finance limited and originally incorporated with the name of GE Money Housing Finance Public Unlimited Company) hereinafter referred as Secured Creditor. You defaulted in repayment and therefore, your loan/s was classified as Non-Performing Assets. A Demand notice under section 13(2) of Securitisation and Reconstruction of Financial Asset and Enforcement of security Interest act 2002 for the recovery of the outstanding dues sent on last know addresses however the same have returned un-served. Hence the contents of which are being Published here with as per section 13(2) of the act read with Rule 3(1) of the security interest (Enforcement) Rules, 2002 as and by way of alternate service upon You. Details of the Borrowers, Co-Borrowers, Guarantors, Securities, Outstanding Dues, Demand Notice sent Under section 13(2) and amount claimed there under are give as under Name of the Borrower, Co-Amount in Demand Notice (Rs.) Description of Property Demand Borrower, Guarantor & Loan All That Right, Title And Interest of Flat No.B/41 Notice Date Loan No: HL0104GAGL00002148 Amount on 4th Floor, Admeasuring 135 Sq. Yds. As A Rs.136554/- (Rupees One Lakh Thirty Six Rajivranjan Diwaker Mishra, Member of Manilaxmi Co-Operative Housing housand Five Hundred Fifty Four Only) together Lakshmi Rajiv Mishra Society Ltd. Vibhag-8 Known As "Hariom Park" with further interest @ 17.33% p.a till Situated At Survey No.33 Paiki [Sub Plot No.40/2] 07/08/2024 Loan Amount: Rs. 1355000/which includes Rs.203000/- vide of Final Plot No.40 of Tps 21 Of Mouje Thaltej Loan No: HL0104GAGL00002133 Loan Account bearing Taluka Daskroi In The Registration District of Rs.955414/- (Rupees Nine Lakh FiftyFive HL0104GAGL00002148 & Ahmedabad And Sub District Ahmedabad-3 Thousand Four Hundred Fourteen Only) together Rs.1152000/- vide a loan account [Memnagari. Particularly Mentioned In Sale with further interest @ 15.56% p.a till bearing no HL0104GAGL00002133 Deed Executed. repayment. Loan No: LAP0626200000005015224 Rajubhai Dahyabhai Bhoi, All That Piece And Parcel of Bearing Non-Rs. 206767/- (Rupees Two Lakh Six Thousand Tarlaben Bhoi Seven Hundred SixtySeven Only) together with Agricultural Plot of Land In Mauje Undel, Loan Amount: Rs. 853000/- which Khambhat Lying Being Land Bearing City Survey further interest @ 15% p.a till repayment. includes Rs. 200000/- vide Loan Loan No: HF0222H20100129 No. 1197 Admeasuring 47.25 Sq. Mtrs., At 07/08/2024 Account bearing Rs.488721/- (Rupees Four Lakh EightyEight Registration District & Sub District Khambhat LAP0626200000005015224 and Thousand Seven Hundred Twenty One Only) District Anand, Particularly Mentioned In Sale together with further interest @ 9.90 % p.a till Rs. 475000/- vide a loan account Deed Executed. Bounded As Under: North: bearing no HF0222H20100129 and Public Road, East: Public Road, South: House of repayment. Loan No: HF0222H21100013 Rs. 178000/- vide a loan account Rs. 201010/- (Rupees Two Lakh One Thousand Arvindbhai Parshotambhai Patel, West: Public bearing no HF0222H21100013 Ten Only) together with further interest @ 17 % p.a till repayment. You the Borrower/s and Co-Borrower/s/Guarantors are therefore called upon to make payment of the above-mentioned demanded amount with further intrest as mentioned hereinabove in full with 60 Days of this notice failing which the undersigned shall be constrained to take action under the act to enforce the above mentioned security/ies. Please note that as per 13(13) of the said act, you are in the meanwhile, Restarined from transferring the abovereferred securities by way of sale, lease or otherwise without our consent

Sd/- Authorised Officer

Grihum Housing Finance Limited, (Formerly known as Poonawalla Housing Finance Limited

EMD

(In Rs.)

8.50,000/-

Sd/- Authorized Officer

Encore Asset Reconstruction Company Pvt. Ltd.

(In Rs.)

AAVAS FINANCIERS LIMITED

Place: Jaipur Date: 21-08-2024

**IDFC FIRST** 

CIN:L65922RJ2011PLC034297) Regd. & Corp. Office: 201-202, 2nd Floor, South End Square, Mansarovar Industrial Area, Jaipur. 302020

AUCTION NOTICE

Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with

proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) rules, 2002 Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Guarantor (s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of AAVAS FINANCIERS LIMITED Secured Creditor, will be sold on "As is where is", " As is what is ", and 'Whatever there is" basis. The details of the cases are as under. Earnest | Date & Date & Amount of Date Reserve Place of Tender Name of Borrowers/ Description of of Poss-Money Submission, Tender Price For Co-Borrowers/ Dues As on Time of 13(2)Demand Open & Auction at Property For

Guarantors/Mortagors Property Auction Notice Property Aavas Financiers Ltd ession NAVIN KHOKHAR, Rs. 7 NOV 23 7 APR PLOT NO. 79, SHUBHNADINI RESIDENCY 11.00 F.11, FIRST FLOOR 124032/ PARULBEN NAVINBHAI PART-2, VILLAGE - DEROD , TAL. KAMREJ, 240320/-AM TO DHARAM EMPIRE 1672606/-Rs. 1498515/-DIST. SURAT GUJARAT ADMEASURING DISTRICT- SURAT, KHOKHAR DUES AS ON DUES AS ON 4 01.00 42.38 SQ. MT. TALUKA: KAMREJ PM 23 (AC NO.) 20 AUG 2024 NOV 23 SEP 2024 MOJE- NAVAGAM LNSRT00319-200119751 394185, GUJARAT-

Ferms & Conditions: 1). The person, taking part in the tender, will have to deposit his offer in the tender form provided by the AFL which is to be collected from the above branch offices during working hours of any working day, super scribing "Tender Offer for name of the property "on the sealed envelope along with the Cheque/DD/pay order of 10% of the Reserve Price as Earnest Money Deposit (EMD) in favour of AAVAS FINANCIERS LIMITED payable at Jaipur on/before time of auction during office hours at the above mentioned offices. The sealed envelopes will be opened in the presence of the available interested parties at above mentioned office of AAVAS FINANCIERS LIMITED The Inter-se bidding, if necessary will also take place among the available bidders. The EMD is refundable if the bid is not successful. 2). The successful bidder will deposit 25% of the bidding amount adjusting the EMD amount as initial deposi immediately or within 24hrs after the fall of the hammer towards the purchase of the asset. The successful bidder failing to deposit the said 25% towards initial payment, the entire EMD deposited will be forfeited & balance amount of the sale price will have to be deposited within 30 days after the confirmation of the sale by the secured creditor; otherwise his initial payment deposited amount will be forfeited. 3). The Authorised officer has absolute right to accept or reject any bid or adjourn/postpone the sale process without assigning any reason therefore. If the date of tender depositing or the date of tender opening is declared as holiday by Government, then the auction will be held on next working day. 4). For inspection and interested parties who want to know about the procedure of tender may contact AAVAS FINANCIERS LIMITED 201,202, lind Floor, South End Square, Mansarovar Industrial Area, jaipur-302020 or Gouray Thakor - 7211137494 or respective branch during office hours. Note: This is also a 15/30 days notice under Rule 9(1)/8(6) to the Borrowers/Guarantors/Mortgagor of the above said loan accounts about tender interse bidding sale on the above mentioned date. The property will be sold, if their out standing duesare not repaid in full

> केनर बैंक 🗱 Canara Bank 2 Rithing day Synton ton

Regional Office, Surat : Western Business Park, 816 to 825, 8th Floor, Udhna Magdalla Road. Vesu, Surat - 395007,

POSSESSION NOTICE

Whereas, The undersigned being the authorized officer of the Canara Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 (Act 54 of 2002) (here in after referred to as "the Act") and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a demand notice date noted against accounts calling upon the Borrowers / Guarantors to repay the amount mentioned in the notices being further interest & Charges less recovery (if any) thereon within 60 days from the date of receipt of the said notices. The Borrower / Guarantor having failed to repay the amount, notice is hereby given to the Borrower / Guarantor and the public in general that the undersigned has taken Possession of the properties described herein below in exercise of powers conferred on him under Sub - section (4) of Section 13 of Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this below mention dated. The Borrower / Guarantor in particular and the public in general are hereby cautioned not to deal with the properties and any dealing with the herein below. The Borrowers' and/or guarantor's attention is invited to provisions of sub section 8 of section-13 of the Act, in respect

Name of the Borrowers	Date of Demand Notice & O/s.Amount Rs.	Description of Immovable Properties	Date of Possession & Branch Name
Mr. Chirag D Desai (Borrower)	14.01.2020 	EMT of Residential Flat situated at Flat No. 207, 2nd Floor, Shubh Mangal Apartment, At - Nandavala, Tal. & Dist. Valsad - 396001. <b>Bounded by :- North</b> : Flat No. 206, <b>South</b> : Margin Place of Plot No. 22, 23 & 24, <b>East</b> : Margin Place of Plot No. 22, 23 & 24, <b>West</b> : Flat No. 208.	20.08.2024 (Symbolic)  (Valsad Branch)
Mrs. Nita Nitesh Vashi (Borrower) W/o Nitesh Mahadevbhai Vashi	08.05.2019 Rs. 10,50,014.65 as on 29.08.2019 & Interest & Other Charges thereon.	EMT of Residential Flat No. 404, 4th Floor, Shubh Mangal Avenue, Survey No. 262/1 Paiki 2, Plot No. 1of Village - Nandavala, Taluka & District - Valsad, Gujarat, Adm. 1204 Sq. ft. Bounded by :- North : Flat No. 401, South : Internal Road, East : Internal Road, West : Property of Plot No. 24.	20.08.2024 (Symbolic)  (Valsad Branch)
Mr. Alkesh Navinbh Lad (Borrower), M Bhavin Navinbhai Li (Co-Borrower) S/o Navinbhai Jagubhai	r	t & Adm. 1241 Sq. ft. Bounded by :- North : Flat No. 202, South	20.08.2024 (Symbolic) ———— (Valsad Branch)

## **RESTILE CERAMICS LIMITED**

Corporate Address: 2B, Devadaya Apartments, #67, Gandhi Nagar, 1st Main Road, Adyar, Chennai Tamil Nadu 600020:

NOTICE OF 38TH ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION AND BOOK CLOSURE

The Annual Report of the Company including AGM Notice for the financial year ended March 31, 2024 ("Annual Report") were sent through electronic mode only to all those members whose email id's are registered with Company or its Registrar and Transfer Agent or the Depositories, in accordance with the MCA circulars and the SEBI circulars and the same has been completed on Monday, August 19, 2024. Members can join and participate in the AGM through VC/ OAVM facility only. The instructions for joining the AGM and the manner of participation in the remote electronic voting or casting vote through the e-voting system during the AGM are provided in the Notice of the AGM. Members participating through the VC/OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Act. The Annual Report is also available on the Company's website at https://www.restile.com/investor-corner/ and on the website of the Stock Exchange i.e. BSE Limited's website at www.bseindia.com and on the website of Central Depository Services (India) Limited ("CDSL") at www.cdslindia.com (agency for providing the e-Voting facility). Members holding shares in physical mode and/ or who have not registered/updated their email address with the Company/ its Registrar and Transfer Agent/ the Depositories and/ or who has acquired shares and become member of the Company after the dispatch of notice and holding shares as of the cut-off date i.e. September 05, 2024 can obtain Annual Report from website of Company/ Stock Exchange/ CDSL and/or login details for joining the AGM through VC/OAVM facility including e-voting by sending scanned copy of: a) Copy of the signed request letter mentioning the folio number/ DP Id and Client Id, name and address of the member; b) Self – attested copy of PAN Card; and c) Self-attested copy address proof (Eg: Aadhar, Driving license, Election Identity Card,

20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended, and Regulation 44 of SEBI Listing Regulations, the Company is providing a facility to the members to cast their votes electronically on all the resolutions set forth in the Notice convening the said meeting ("e-voting"). The Company has availed the services of CDSL to provide the facility of remote e-voting /e-voting at the AGM. Members whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting in the meeting. The voting rights of Members shall be in proportion to their shares in paid up equity capital of the Company as on cut-off date i.e. September 05, 2024.

The Remote e-voting shall commence on September 09, 2024 at 10:00 A.M. (IST) and ends on September 11, 2024 at 05:00 P.M. (IST). During this period shareholders of the Company, holding shares either in physical form or in dematerialised form, as on the cut – off date i.e. September 05, 2024 may cast their vote electronically. The remote e-voting module shall be disabled by the CDSL for voting thereafter. The facility of e-voting will also be made available at the AGM. Only those members attending the AGM through VC/OAVM, who have not cast their vote by remote e-voting and are otherwise not barred from doing so, will be able to vote at the AGM. A member may participate in the general meeting even after exercising his right to vote through remote e-voting but shall not be

Any person, who acquires shares of the Company and becomes a member of the Company after

The detailed instructions for joining the AGM through VC/ OAVM and casting the vote through remote

Viren Rathod **Managing Director** 

Email: recoveryrosurat@canarabank.com

(For Immovable Properties)

**Authorised Officer Aavas Financiers Limited** 

properties will be subject to charge of Canara Bank for the amounts and further interest thereon mentioned against each accounts of time available, to redeem the secured assets.

Name of the Borrowers	Date of Demand Notice & O/s.Amount Rs.	Description of Immovable Properties	Date of Possession & Branch Name
Mr. Chirag D Desai (Borrower)	14.01.2020 	EMT of Residential Flat situated at Flat No. 207, 2nd Floor, Shubh Mangal Apartment, At - Nandavala, Tal. & Dist. Valsad - 396001. <b>Bounded by :- North</b> : Flat No. 206, <b>South</b> : Margin Place of Plot No. 22, 23 & 24, <b>East</b> : Margin Place of Plot No. 22, 23 & 24, <b>West</b> : Flat No. 208.	20.08.2024 (Symbolic)  (Valsad Branch)
Mrs. Nita Nitesh Vashi (Borrower) W/o Nitesh Mahadevbhai Vashi	08.05.2019  Rs. 10,50,014.65 as on 29.08.2019 & Interest & Other Charges thereon.	EMT of Residential Flat No. 404, 4th Floor, Shubh Mangal Avenue, Survey No. 262/1 Paiki 2, Plot No. 1of Village - Nandavala, Taluka & District - Valsad, Gujarat, Adm. 1204 Sq. ft. Bounded by :- North : Flat No. 401, South : Internal Road, East : Internal Road, West : Property of Plot No. 24.	20.08.2024 (Symbolic)  (Valsad Branch)
Mr. Alkesh Navinbh Lad (Borrower), Mr Bhavin Navinbhai La (Co-Borrower) S/o Navinbhai Jagubhai L	Rs. 9,39,512.85 as 04.10.2021 & Interes	t & Adm. 1241 Sq. ft. Bounded by :- North : Flat No. 202, South	20.08.2024 (Symbolic)  (Valsad Branch)

(CIN: - L26931GJ1986PLC102350) Registered Address: 204, Sakar Complex, Opp. Abs Tower, Vaccine Crossing, Old Padra Road, Vadodara, Gujarat 390015;

Email: restile@accountscare.com; Website: www.restile.com

In continuation of our newspaper notice published on Saturday, August 17, 2024, NOTICE is hereby given that the 38th Annual General Meeting ('AGM/ the Meeting') of the Members of RESTILE CERAMICS LIMITED ('the Company') will be held on Thursday, September 12, 2024 at 12:00 Noon (IST) through Video Conferencing ('VC')/ Other Audio Visual Means ('OVAM'), to transact the business as stated in the AGM Notice, in compliance with the applicable provisions of the Companies Act, 2013 ("the Act") and the rules made thereunder and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations"), read with Circular No. 14/2020 dated April 08, 2020, Circular No. 17/2020 dated April 13, 2020 issued by the Ministry of Corporate Affairs followed by Circular No. 20/2020 dated May 05, 2020, Circular No. 02/2021 dated January 13, 2021, Circular No. 21/2021 dated December 14, 2021, Circular No. 02/2022 dated May 05, 2022 and Circular No. 10/2022 dated December 28, 2022 (collectively referred to as 'MCA Circulars'), and Securities and Exchange Board of India vide its Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020, SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11, dated January 15, 2021, SEBI/HO/CFD/ CMD2/CIR/P/2022/62, dated May 13, 2022 and SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 05, 2023 (collectively referred to as "SEBI Circulars") and all other relevant circulars issued from time to time and all other relevant circulars issued from time to time, without the physical presence of the Members at a common venue.

Passport) of the member by email to cs@restile.com and cameo@cameoindia.com.

NOTICE is also hereby given that pursuant to the provisions of Section 108 of the Act read with Rule

allowed to e-vote again in the meeting.

dispatch of the AGM Notice and holding shares as of the cut-off date may obtain login id and password by sending a request at evoting@cdsl.co.in and also refer to the voting instructions on the CDSL website. However, if he/she is already registered with CDSL for remote e-voting then he/ she can use his/her existing User ID and password for casting vote or following the procedure as mentioned in the AGM Notice. Further, any person, who ceases to be the Member of the Company as on the cut-off date and is in receipt of this communication, shall treat the same for information purpose only.

e-voting/ e-voting at the AGM is provided in the Notice of the AGM. Members are requested to carefully go through the same. Members, who need assistance and/or having any grievances before or during the AGM regarding e-voting facility and/ or VC/ OAVM facility, can send a request to Rakesh Dalvi, Sr. Manager, (CDSL) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 at helpdesk.evoting@cdslindia.com or call on toll free no.: 1800 21 09911 or email at cs@restile.com. NOTICE is also hereby given that pursuant to section 91 of the Act read with Rules made thereunder, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from September 06, 2024 to September 12, 2024 (both days inclusive) for the purpose of Annual General

For and on behalf of the Board of Direcotrs of Restile Ceramics Limited

DIN: 03407158

**IDFC FIRST Bank Limited** 

(erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) | CIN : L65110TN2014PLC097792 Registered Office: - KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai- 600031. Tel: +91 44 4564 4000 | Fax: +91 44 4564 4022

NOTICE UNDER SECTION 13 (2) OF THE SECURITIZATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 The following borrowers and co-borrowers availed the below mentioned secured loans from IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) The loans of the below-mentioned borrowers and co-borrowers have been secured by the mortgage of their respective properties. As they have failed to adhere to the terms and conditions of the respective loan agreements and had become irregular, their loan were classified as NPA as per the RBI guidelines, Amounts due by them to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated

with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) are mentioned as per respective

notices issued more particularly described in the following table and further interest on the said amounts shall also

be applicable and the same will be charged as per contractual rate with effect from their respective dates. Name of borrowers and | Section 13 (2) Outstanding amount as per Loan Type of No. Account No. Loan Section 13 (2) Notice Notice Date co-borrowers Loan 1. Maheshkumar Amaratii Thakor 20.07.2024 INR 3,11,237,10/-(in The Capacity Of Available Legal Heir Of Late Amaratji Property Dahyaji Thakor) Maheshkumar Amaratji Thakor Somiben Thakor Somiben Thakor (in The Capacity Of Available Legal Heir Of Late Amaratii Dahyaii Thakor)

Property Address: All That Piece And Parcel Of Aamja Gram Panchayat Property No. 495, Assessment Serial No. 502 "thakor Vas" (Gamthan), Admeasuring 800.00 Sq. Ft., Situated At Aamja, Ta.: Kalol, District Gandhinagar, State:- Gujarat-382735, And Bounded As: East: Property Of Javaji Dhanaji Thakor, West After Road, Property Of Prahladji Javaji, North: Property Of Ranchhodji Dahyaji Thakor, South: Road You are hereby called upon to pay the amounts to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) as per the details shown in the above table with contracted rate of interest thereupon from their respective dates and other costs charges etc., within 60 days from the date of this publication, failing which the undersigned shall be constrained to initiate proceedings, under Section 13 (4) and section 14 of the SARFAESI Act, against the mortgaged properties mentioned hereinabove to realize the amount due to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited). Further you are prohibited under Section 13 (13) of the said Act from transferring the said secured assets either by way of sale/lease or otherwise.

Sd/- Authorized Officer **IDFC First Bank Limited** (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited Date: 21.08.2024 and presently known as IDFC First Bank Limited) Place : Gujarat

ELECTROTHERM (INDIA) LTD. Regd. Office: A-1, Skylark Apartment, Satellite Road, Satellite, Ahmedabad-380015 CIN: L29249GJ1986PLC009126 | Email: sec@electrotherm.com Website: www.electrotherm.com | Phone: +91-79-26768844 | Fax: +91-79-26768855

Encore Asset Reconstruction Company

Encore ARC Corporate Office Address: 5TH FLOOR, PLOT NO. 137,

SECTOR 44, GURUGRAM - 122 002, HARYANA

E-AUCTION SALE NOTICE

E-Auction Sale Notice for Sale of Immovable Asset under the Securitisation and

Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read

Notice is hereby given to the public in general and in particular to the Borrower and

Guarantor(s) that the below described immovable property mortgaged/charged to the India

Infoline Finance Limited (IIFL) Bank to secure the outstanding dues in the loan account

since assigned to Encore Asset Reconstruction Company Private Limited, acting in its

capacity as the trustee of EARC -EOT- 001 -Trust ("Secured Creditor"), which is under

Physical Possession of the Authorised Officer of the Secured Creditor, will be sold on "AS

IS WHERE IS", "AS IS WHAT IS", and "WHATEVER THERE IS" basis on 09.09.2024 for

recovery of Rs. 1,41,20,331/- (Rupees One Crore Forty One Lakhs Twenty Thousand

Three Hundred Thirty One Only) as on 30.04.2024 and further interest at contractual rate till

to the Secured creditor from borrower Mr. Shaileshbhai Chovatiya (Borrower) and (1) Mr.

Vina Shaileshbhai Chovatiya (2) Mr. Savdas Chovatiya (Deceased) through its legal heirs

The description of the property, Reserve Price (RP) for the secured asset & the Earnest

In case the e-auction date is declared public holiday then the date will be automatically

For detailed terms & conditions please refer to the link provided in the secured

For any clarification/information, interested parties may contact the Authorised Officer of the

Secured Creditor on mobile no. 9930171113 / 9712668557 or email at

(Hereinafter collectively referred as Co-Borrower)

Description of the Immovable

Constructed Residential House No. 3 situated on the land

No. 33/B of Revenue Survey No. 78 paikee of village Raiya.

District Rajkot. The property is bounded as under: North:

Road, South: Plot No. 33/A, East: House No. 2, West: Plot

creditor's website i.e., http://www.encorearc.com/

adm, Sq. Mts. 75-48 of Sub-Plot No. 33/B+2+3 paikee of Plot 85.00.000/-

Money Deposit (EMD) is be as under.

Secured Asset

extended to very next working day.

dharmendra.maurya@encorearc.com

No. 33/B-4

Date: 20.08.2024

Place: Pune

covery and other costs, charges etc. after adjustment of recovery/realization, if any, due

with Proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002 (Rules).

earc Private Limited (Encore Arc)

NOTICE OF 38™ ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 38" Annual General Meeting ("AGM") of the Members of Electrotherm (India) Limited ("Company") will be held on Thursday, 12" September, 2024 at 11:00 a.m. through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the businesses, as set out in the Notice

In accordance with the applicable provisions of the Companies Act, 2013, SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with Ministry of Corporate Affairs Circular No.14/2020 and 17/2020 dated 8th April, 2020 and 13" April, 2020 and Circular 20/2020, 02/2021, 19/2021, 21/2021, 02/2022 10/2022 and 09/2023 dated 5" May, 2020, 13" January, 2021, 8" December, 2021, 14" December, 2021, 5" May, 2022, 28" December, 2022 and 25" September, 2023 respectively ('MCA Circulars') and SEBI Circular No.SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/167 dated 07" October, 2023 ("SEBI Circular"), the Notice of AGM along with Annual Report of the Company for the financial year ended on 31" March, 2024 has been sent to all the Members whose e-mail addresses are registered with the Company / Depository Participants (DP) / Registrar & Share Transfer Agent (RTA). A copy of the Notice of AGM along with Annual Report are available on the website of (i) the Company at www.electrotherm.com, (ii) the BSE Limited (BSE) at www.bseindia.com and National Stock Exchange of India Limited (NSE) at www.nseindia.com, and (iii) Central Depository Services (India) Limited (CDSL) at www.evotingindia.com. The Members can attend and participate in the AGM through VC / OAVM only.

In compliance with the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, read with MCA Circulars, the Members are provided with the facility to cast their vote by electronic means through the remote e-voting or through e-voting at the AGM by using the platform provided by CDSL The website for attending AGM through VC / OAVM and e-voting is: www.evotingindia.com. The voting right of the Members shall be in proportion to one vote per fully paid equity share of the Company held as on cut-off date i.e. Thursday, 05" September, 2024. Detailed procedures for attending AGM through VC / OAVM and voting by electronic means are provided in the Notice of the 38" AGM. Attendance of Members through VC / OAVM will be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

The remote e-voting period will commence from Monday, 09th September, 2024 at 9:00 a.m. and will end on Wednesday, 11" September, 2024 at 5:00 p.m. No remote e-voting shall be allowed beyond the said date and time. A person, whose name appears in the Register of Members / Beneficial owners as on cut-off date i.e. Thursday, 05" September, 2024 only shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting during the AGM.

In case, any person who becomes a member of the Company after dispatch of AGM Notice and Annual Report but on or before the cut-off date i.e. Thursday, 05" September, 2024, such member may write to Link Intime India Private Limited. Registrar & Share Transfer Agent (RTA) on the email id ahmedabad@linkintime.co.in requesting for the User Id and Password for e-voting.

The members who will be attending the AGM and who have not cast their vote through remote e-voting shall be able to exercise their voting rights at the AGM. The Members who have cast their vote by remote e-voting prior to the meeting may also attend the meeting but shall not be entitled to cast their vote again.

If you have any queries or issues regarding attending AGM & e-voting from the CDSL e-voting System, you can write an email to helpdesk.evoting@cdslindia.com or contact at toll free No. 1800 225533

All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Sr. Manager, Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds. N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400 013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call toll free No. 1800 22 55 33.

For Electrotherm (India) Limited Fageshkumar R. Soni Place: Palodia **Company Secretary** (Membership No. F8218) Date: 20" August, 2024



Home Loan Centre Ashram Road (61132), STATE BANK OF INDIA 1st, Floor, Vedanta Complex, Opp. Usmanpura Garden, Usmanpura Cross Road, Ashram Road, Ahmedabad - 380014

Notice is hereby given under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13 (2) read with Rule 8 & 9 of the Security Interest (Enforcement) Rules, 2002, a demand notice was issued on the dates mentioned against each account and stated hereinafter calling upon them to repay the amount within 60 days from the date of receipt of said notice.

APPENDIX-IV [See Rule - 8(1)) POSSESSION NOTICE (FOR IMMOVABLE and Movable PROPERTY)

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13 (2) of the said Act read with Rule 9 of the said Act on the dates mentioned against each account.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the State Bank of India for an amount and interest thereon.

<u> </u>	Description of the Immov	able Propert	y	
Name of the Borrower / Guarantor/Mortgagor	Description of Properties	Outstanding Amount	Date of Demand Notice	Date of Possessio
Mr Lenin Maheshbhai Solanki,	All that Piece and Parcial of immovable property at block no 7 [Building No L-7] Flat no 75 Adm., About 58.20 Sq Mtrs. On ground Floor in the Scheme Known as Navnirman Nagar Associates also	11.03.2024 Rs 6,74,847/-+ Futher Interest & Expenses	12.03.2024	17.08.2024 Symbolic Possessio
33./1 situated at Mouje	agar Constructed by Gujarat Housing Board situated a Vadaj [Narayanpura] Taluka City District Ahmedaba ath:-Flat no 74, East:-open land, West: Open Land an	d and Registration Su		
Mr Santosh A Marwadi Ashok H Ravat	All that piece and parcel of Immovable Property being "Flat No.G/309, Navjivan Vihar, Geratpur, Ahmedabad. (Revenue Survey No. 306, Final Plot No.254, Town Planning No. 413, Geratpur, Dist	25/12/2023 Rs 9,87,694/-+ Futher Interest & Expenses	26.12.2023	16.08.2024 Symbolic Possessio
Ahmedabad admeasur	ring 50 Sq Mtrs. Boundries: East: G 310, West: G 308	North : Block F, Sout	th: Staires	
Mr. Tiwari Pramod Madan, Mrs. Babita Pramod Tiwari	All that piece and parcel of Immovable Property being Flat No. B-604, Murlidhar Height Mouje - Muthiya, Ahmedabad (Survey No. 96+98/B, Final Plot No. 34/2, T.P.S No. 75 (Hansapura-	21/05/2024 Rs 25,19,716/-+ Futher Interest & Expenses	22.05.2024	16.08.2024 Symbolic Possessio
Naroda-Muthiya) Bou South : Flat No.B-603	undries: East: Door of Property & Stairs, West:	Block No. C. North	: Common Plot	after Margi
Mrs Jital M Joshi Mukesh H Joshi	All that Piece and parcel of immovable properly bearing Flat no 38 in the Scheme Known as ARJUN APPARTMENT situated at Ranip SR NO 343/2 FP no 1 TPS No 95/P Area 64.37 Sq Mtrs District	30/11/2023 Rs 13,65,441/-+ Futher Interest & Expenses	31.11.2023	17.08.2024 Symbolic Possessio
Ahmedabad: North: -F	Road, South:-Flatno 37, East:-Flat No 39, West: Road	d		
Mr. Ariyan Leena Sharma	All that piece and parcel of Immovable Property being Flat No. B-206, Shree Ram Residency, Mouje- Vatva. (Survey No. 552/1/1p, 552/l/2p, 552/2p, Final Plot No. 36, T.P.S No. 58,	19/02/2024 Rs 19,51,325/-+ Futher Interest & Expenses	20.02.2024	16.08.2024 Symbolic Possessio
Ahmedabad admeasu South: Flat No. B-207	ring Area 39.41 SQ. Mtrs.) Boundries: East : Flat No	. B-209, <b>West</b> : Socie	ty Road, North:	Society Road
Mrs Dakshaben Jayeshbhai Panchal Jayeshbhai Bhaichandanbhai Panchal	All that Piece and parcel of immovable property beaing H 607,280 LIG 1 Mouje Chenpur, Ahmedabad Boundries: North:- Flat NO 606, South:-Road, East:- Block No G, West: Flat No. 608	01/04/2024 Rs 7,63,773/-+ Futher Interest & Expenses	02.04.2024	17.08.2024 Symbolic Possessio
Mr Valal Dhruvangbhai Sanjaybhai	All that Piece and parcel of immovable property being the block B Flat No 803 Murudhar Height Mouje Muthiya Ahmedabad North:-Flat No B 804, South:- Final Plot no 35/3 [Vraj Galaxy] After	29/05/2024 Rs 30,35,338/-+ Futher Interest & Expenses	30.05.2024	20.08.202 Symbolic Possessio

Date: 21.08.2024 Sd/- Authorized Officer, State Bank of India, RACPC, Ashramroad. Place: Ahmedabad

Comon Margin, East:- Door of Property and Margin

All that Piece and parcel of immovable property

being the Bunglow No 44 Samast Brahamshatyiya

Society Narayannagar Paldi Ahmedabad SR NO

54 FP No. 76 TPS No 22 Adm Area 444.89 Sq Mtrs.

North:- Bunglow no 55, South:- Bunglow no 53,

East:- Bunglow No 57 & 58, West:-12.19 Mtrs

of lift . West: - Block No C

Wide Tps Road [Brts Corridor]

Mrs. Nilaben

Kishorchand Desail

Ahmedabad

financialexp.epapr.in

09/06/2024

Rs 3,86,38,335/-+

Futher Interest &

Expenses

20.08.2024

Symbolic

Possession

Place: Vadodara

**Date: August 21, 2024** 

10.06.2024



# એયુ સ્મોલ ફાયનાન્સ બેન્ક લિમિટેડ (શેડયૂલ્ડ કોમર્શિયલ બેન્ક) ૨જી .ઓફિસ. ૨જીસ્ટર્ડ ઓફિસ. 19-એ, ધુલેશ્વર ગાર્ડન,

અજમેર રોડ, જયપુર -302001 (CIN: L36911RJ1996PLC011381)

IV એપેન્ડિક્સ [જુઓ રુલ 8 (1)] કબજાની નોટિસ

આથી અહીં નીચે સહી કરનાર એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ (જે હવે પછી "ઘી "બેન્ક" તરીકે ઉલ્લેખાશે જેનો અભિવ્યક્તિ સંદર્ભ "ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડ "થાય (જે આર.બી.આઈની માન્યતા પછી એપ્રિલ 01 2024 ના રોજથી એ.યૂ. સ્મોલ ફાયનાન્સ બેન્ક સાથે ભેળવી દેવામાં આવી છે) અધિકૃત અધિકારી તરીકે સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રકશન ઓફ ફાઇનાન્સિયલ એસેટસ એન્ડ એન્ડોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ [એક્ટ 2002(2002નં 54)] અને સેકશન 13(12) કે જે સિક્યુરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ ફલ્સ 2002ના રુલ 3 સાથે વંચાણ માં લેવામાં આવે તે અંતર્ગત આપવામાં આવેલ સત્તાની રૂએ ઉધાર લેનારાઓ, ગોરોદાર, સહ-ઉધાર લેનારાઓ અને જામીનદારોને આ માંગણા નોટિસ તારીખ થી 60 દિવસ (સાહીંઠ દિવસ) ની અંદર ઉપરોક્ત ડિમાન્ડ નોટિસ માં જણાવેલી ૨કમ ચૂકવવા માટે જણાવવામાં આવ્યું હતું. નીચે જણાવેલ નાણાં લેનારાઓએ મિલકત સામે ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડ કે જે હવે એયુ સ્મોલ ફાયનાન્સ બેન્ક લિમિટેડમાં અને સાથે ભળી ગઈ છે. એટલે માંગણા નોટિસ મેળવનાર નાણા લેનાર પાસેથી ક્રેડિટ ફેસીલીટી મુજબ અગાઉથી માગવા સંપૂર્ણ હક્કદાર છે. અને દરેક અથવા કોઈપણ બાકી લેણાં ."એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ"ની તરફેણમાં આપવાના રહેશે.ઉધાર લેનારાઓ, મોર્ટગેજર્સ, કો-ઓબ્લિગન્ટ્સ અને સંમતિ આપનારાઓ, અને જાહેર જનતાને નોટિસ આપવામાં આવે છે કે સદર એક્ટના સેક્શન 13ના સબ સેક્શન 4 કે જે સિકયુરિટી ઇન્ટરેસ્ટ (એન્ફ્રોર્સમેન્ટ)ટ્રલ્સ 2002 ના રુલ 9 સાથે વંચાણમાં લેવામાં આવે તે અંતર્ગત આપવામાં આવેલી સત્તાની રૂએ નીચે સહી કરનારે અહીં નીચે વણવેલ મિલકત/મિલકતોનો સકિતિક કબજો લઇ લીધો છે. આથી નાણાં લેનારાઓને એક્ટના સેક્શન 13ના સબ સેક્શન (8) ની જોગવાઈઓ અનુસાર ધ્યાન દોરવામાં આવે છે કે હજી સમય છે તો આરક્ષિત મિલ્કતને રીડીમ કરાવી શકે છે. આથી ઉપરોક્ત જણાવેલ નાણા લેનાર, મોર્ટગેંજર્સ, સહયોગી નાણા લેનારા, સહમતી આપનારા તેમજ જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે કે સદર મિલકત/મિલકતો સાથે કોઈ વહેવાર કરવો નહિ અને આ મિલકત સાથેનો કોઈ પણ વહેવાર એયુ સ્મોલ ફાયનાન્સ લિમિટેડ ને બાકી લેણી રકમ અને તે પરના નાણાની સંપૂર્ણ ચુકવણી સુધીના વ્યાજ, ખર્ચ અને અન્ય ચાર્જીસ સાથે ચૂકવવા જવાબદાર રહેશે.

ક્રમ નં.	નાણા લેનારનું નામ/સહયોગી નાણા લેનારનું નામ/મોર્ટગેજર/ જામીનદારના નામ/એકાઉન્ટ નં અને માંત્રણા નોટિસ તારીખ	કબજા લીધા તારીખ	કુલ બાકી લેણાની રકમ
1.	શ્રી/શ્રીમતી રબારી ગમનભાઈ વાલજીભાઈ, શ્રી/શ્રીમતી. રબારી આશાબેન ગમનભાઈ લોન એકાઉન્ટ નં. 19660000477892 માંગણા નોટિસ તારીખ 28-11-2023	16/08/2024 સકિતિક કબજો	રૂ. 261953/- (રૂપિયા બે લાખ એકસદ હજાર નવસી ત્રેપન માત્ર) તા.21 નવેમ્બર 2023 મુજબ સુધીના

**રવાવર મિલકતનું વિવરણ :** દરેક ભાગો અને વિભાગોની સ્થાવર મિલકત, બેરિંગ પ્રોપર્ટી નં-507, ગ્રામ પંચાયત ક્રમાંક-507, જે હાથીપુરા, તા-વિજાપુર જિલ્લો-મહેસાણા ખાતે આવેલું છે પૂર્વથી પશ્ચિમ માપનઃ 15.00 થો.ફૂટ. અને ઉત્તરથી દક્ષિણઃ 35.00 Sq.Ft. ટોટલી મેઝરિંગ 525.00 Sq.Ft. તેમાં વર્તમાન અને ભાવિ બાંધકામની સાથે, દ્વારા બાઉ-ડેડઃ. અને **પૂર્વથીઃ** ઠાકોર વાસ, **પશ્ચિમ માં**ઃ જાહેર માર્ગ પર બંધાયેલ છે, **ઉત્તરથી**ઃ મંગુબેન પુંજાભાઈ રબારીની મિલકત, **દક્ષિણ દ્વારા**ઃ વિહતમાતા અને ચામુંડમાતાનું મંદિર અને તેમાં વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે બંધાયેલ છે.

2.	શ્રી/શ્રીમતી કનુભાઈ પાસાભાઈ રાવલ, શ્રી/શ્રીમતી. કાશીબેન પરસોત્તમભાઈ રાવલ લોન એકાઉન્ટ નં. 1866000095042 અને 21660000455386 માંગણા નોટિસ તારીખ 28-11-2023	17/08/2024 સકિતિક કબજો	રૂ. 142578/- (રૂપિયા એક લાખ બેતાલીસ હજાર પાંચસો ઈઠિયોતેર માત્ર) તા.21 નવેમ્બર 2023 મુજબ સુધીના
----	--	---------------------------	---

સ્થાવર **સિવકતનું વિવરણ** : દરેક ભાગો અને વિભાગોની સ્થાવર મિલકત, પ્લોટ નં-36, સર્વે નં-4, ચલતા, નં-10, સિટી સર્વે નં-1853, રેવન્યુ સર્વે નં-2401/1, આટ-બલોલ તા અને જિલ્લો-મહેસાણા માપણી પૂર્વથી પશ્ચિમ : અને ઉત્તરથી દક્ષિણ : સંપૂર્ણ રીતે 41.04 ચો.મી. તેમાં વર્તમાન અને ભાવિ બાંધકામની સાથે, આના પર બાઉન્ડેડઃ. અને પર બંધાયેલ, **પૂર્વ દ્વારાઃ** ખુલ્લી જમીન, **પશ્ચિમ દ્વારાઃ** ખુલ્લી જમીન, **ઉત્તર દ્વારાઃ** સિટી સર્વે નં. 1854, **દક્ષિણ દ્વારા**ઃ સિટી સર્વે નંબર 1852 અને તેમાં વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે બંધાયેલ છે.

L				
	3.	શ્રી/શ્રીમતી પટેલ કેશરભાઈ શામલાભાઈ, શ્રી/શ્રીમતી હંશાબેન કેશરભાઈ કરેણ લોન એકાઉન્ટ નં. 19660000372829 અને 21660000156659 માંગણા નોકિસ તારીખ 28-11-2023	17/08/2024 સાંકેતિક કબજો	ટ્રે. 285364/- (રૂપિયા બે લાખ પંચ્યાસી હજાર ત્રણસો ચોસઠ માત્ર) તા.21 નવેમ્બર 2023 મુજબ સુધીના

**સ્થાવર પ્રિલકતનું વિવરણ :** દરેક ભાગો અને વિભાગોની સ્થાવર મિલકત, જુના ગામતાલ, અટ-મેરવાડા, તાલ-પાલનપુર જિલ્લો-બનાસકાંઠા, રાજ્ય ગુજરાત મેઝરિંગ ઇસ્ટ ટુ વેસ્ટ: 15.00 ચો.ફૂટ. અને ઉત્તરથી દક્ષિણ: 40.00 Sq.Ft. ટોટલ મેઝરિંગ 600.00 Sq.Ft. તેમાં વર્તમાન અને ભાવિ ખાંધકાંમની સાથે, અને આના દ્વારા બંધાયેલ:. અને પર બંધાયેલ, **પૂર્વે**: જેસંગભાઈ શામળાભાઈનું ઘર આવેલું છે, **પશ્ચિમમાં** : સરદારભાઈ શામલભાઈનું ઘર આવેલું છે, **નોર્થમાં** : રોડ આવેલો છે, **સાઉષમાં** : રોડ સ્થિત છે અને તેમાં વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે બંધાયેલ છે.

શ્રી/શ્રીમતી અશોકભાઈ ત્રિભોવનભાઈ મેવાડા, શ્રી/શ્રીમતી નિકીતાબેન અશોકભાઈ મેવાડા લોન એકાઉન્ટ નં. 18660000061307 માંગણા નોટિસ તારીખ 26/02/2024	17/08/2024 સાંકેતિક કબજો	ફ. 122236/- (રૂપિયા એક લાખ બાવીસ હજાર બેસો છત્રીસ માત્ર) તા.21 ફેબ્રુવારી 2024 મુજબ સુધીના
--	-----------------------------	---

**સ્થાવર મિલકતનું વિવરણ** : દરેક ભાગો અને વિભાગોની સ્થાવર મિલકત, જૂના ગામતળમાં બેરિંગ પ્રોપર્ટી નંબર-3338 મકાન નં-14 કુલ 53.90 ચોરસ મીટર ગઢના સિમમાં આવેલું છે. તાઃ પાલનપુર જિલ્લો-બંસકાંઠા, રાજ્ય ગુજરાત નોધણી જિલ્લો પાલનપુરનો પેટા જિલ્લો પૂર્વથી પશ્ચિમ માપન લંબાઈ: 29-00 ફિટ. અને દક્ષિણ તરફ ઉત્તરની પહોળાઈ; 20-00 ફિટ. કુલ એડમેઝરિંગ 580-00 ચો.ફિટ્સ સાથે ત્યાં વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે, અને આના દ્વારા બાઉન્ડેડઃ અને પર બંધાયેલ, **ઇસ્ટમાં**ઃ અમૃતભાઈ પટેલના ઘરની બાજુમાં, **વેસ્ટમાં**ઃ નવીનભાઈ ઠક્કરનું ઘર બાજુમાં, **નોર્ચમાં**ઃ રોડ આવેલો છે, **સાઉથમાં**ઃ રોડ સ્થિત છે અને તેમાં વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે બંધાયેલ છે.

_	_			
	5.	શ્રી/શ્રીમતી વાલેલા સૂર્યાબેન જગદીશજી, શ્રી/શ્રીમતી વાલેલા દેવેન્દ્રસિંહ જગદીશસિંહ લોન એકાઉન્ટ નં. 19660000477502 માંગણા નોટિસ તારીખ 26/02/2024	17/08/2024 સકિતિક કબજો	રૂ. 142599/- (રૂપિયા એક લાખ બેતાલીસ હજાર પાંચસો નવ્વાણું માત્ર) તા.21 ફેબ્રુવારી 2024 મુજબ સુધીના

**રવાવર મિલકતનું વિવરણ :** દરેક ભાગો અને વિભાગોની સ્થાવર મિલકત, બેરિંગ નંબર મિલ્કત નંબર-1392, રબારી વાસ, પાસે ગામ-ધમસણા તા-કલોલ જિલ્લો-ગાંધીનગર પૂર્વથી પશ્ચિમ માપનઃ 50 અને ઉત્તરથી દક્ષિણ; 15 કુલ 750 ચો.ફટનું માપન વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે, અને આના દ્વારા બંધાયેલ છેઃ અને પર બંધાયેલ, **પૂર્વથી ઃ** જાહેર માર્ગ, **પશ્ચિમમાં ઃ જાહેર માર્ગ, ઉત્તરથી ઃ** વાઘેલા કીર્તિસિંહ સંભુજીનું ઘર, **સાઉથમાં ઃ** ઓપન પ્લોટ અને તેમાં વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે બંધાયેલ છે.

6.	શ્રી/શ્રીમતી જાદવ કીર્તિકુમાર મંગળદાસ, શ્રી/શ્રીમતી વણકર કેશરબેન મંગળદાસ, જાદવ સ્નેહલબેન કીર્તિકુમાર લોન એકાઉન્ટ નં. 20660000108212 માંગાગા નોટિય તાટીખ 26/02/2024	16/08/2024 સાંકેતિક કબજો	રૂ. 184614/- (રૂપિયા એક લાખ ચોર્ચાસી હજાર છસો ચૌદ માત્ર) તા.21 કેબ્રવારી 2024 મજબ સધીના

**રવાવર મિલકતનું વિવરણ** : દરેક ભાગો અને વિભાગોની સ્થાવર મિલકત, બેરિંગ નંબર-નવી મિલકત નં-4/75, (જૂની મિલકત નં-4/77/1) ગ્રામ પંચાયત ક્ર ાં-895, જે કડા સિમ, તા-વિસનગર સ્થિત છે. પૂર્વથી પશ્ચિમનું માપનઃ અને ઉત્તરથી દક્ષિણઃ સંપૂર્ણપણે માપન 61.182 ચો.મીટર સાથે વર્તમાન અને ભાવિ નટલાઈ ગોવાલાઈની મિલકત. **વેસ્ટમાં :** રોડ. **નોર્થમાં :** રોડ. **સાઉથમાં :** રોડ અને તેમ

ı	કાન સાવ, બાઉન્ડ આન, અન પર બવાવલ, <b>યૂપથા</b> ર પરમાર નેટુભાઇ ગ ાન અને ભાવિ બાંધકામ સાથે બંધાયેલ છે.	ાવાભાઇના ાનવકત, વ	ભ્રષ્ટમા : રાડ, નાવમા : રાડ, સાલવમા : રાડ અન ત
7.	શ્રી/શ્રીમતી ચારોલિયા વારીસાલી ગુલામભાઈ, શ્રી/શ્રીમતી ચારોલિયા કુલસુમબેન શબીરહાસન, ચારોલિયા સબિરાલી ગુલામભાઈ લોન એકાઉન્ટ નં. 1866000058773	17/08/2024 સાંકેતિક કબજો	રૂ. 120384/- (રૂપિયા એક લાખ વીસ હજાર ત્રણસો ચોર્યાસી માત્ર) તા 21 કેબવારી 2024 પ્રજબ સ્થીતા

માંગણા નોટિસ તારીખ 26/02/2024 **સ્થાવર મિલકતનું વિવરણ** : દરેક ભાગો અને વિભાગોની સ્થાવર મિલકત, બેરિંગ પ્રોપર્ટી નંબર-1236, એ.એસ. NO-1238 જુના ગામતળમાં કુલ 55.76 ચોરસ મીટરનું માપન પિરોજપુર તા.વડગામ, જિલ્લો-બનાસકાંઠા રાજ્ય ગુજરાત નોંધણી જિલ્લો વડગામનો પેટા જિલ્લો અને પૂર્વથી પશ્ચિમમાં લંબાઈ માપવા: 15-00 ફીટની સિમમાં સ્થિત છે. અને પહોળાઈ ઉત્તરથી દક્ષિણ: 40-00 ફિટ. વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે કુલ 600-00 ચોરસ ફીટ માપન, અને આના દ્વારા બાઉન્ડેડઃ. અને પર બંધાયેલ, **ઇસ્ટમાં** : રોડની બાજુમાં, **વેસ્ટમાં** : રોડની બાજુમાં, **ઉત્તરથી**: સબ્બીરાલી ચારોલિયાના ઘરની બોજુમાં, **દક્ષિણ દ્વારા** મકબરાલી ચારોલિયાના ઘરની બાજુમાં અને તેમાં વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે બંધાયેલ છે.

તા.21 ફેબ્રુવારી 2024 મુજબ સુધીના

3.106839/-

(રૂપિયા એક લાખ છુ હજાર આઠસો

Place: Vadodara

Date: August 21, 2024

8.	શ્રી/શ્રીમતી જીગર દશરષભાઈ નાયી, શ્રી/શ્રીમતી દશરષભાઈ આશાભાઈ નાયી, કંચનબેન દશરષભાઈ નાયી લોન એકાઉન્ટ નં. 18660000002169	17/08/2024 સાંકેતિક કબજો	ફે.208161/- (રૂપિયા બે લાખ આઠ હજાર એક્સો એક્સઠ માત્ર)		

માંગણા નોટિસ તારીખ 26/02/2024 **સ્થાવર પ્રિલકતનું વિવરણ** : દરેક ભાગો અને વિભાગોની સ્થાવર મિલકત, બેરિંગ હાઉસ નં.1/172/2 આશરે 62.70 ચો.મી. નથી વાસ. પિયાજ. વિલાગ-પિયાજ, તાલ-કર્લોલ જિલ્લો-ગાંધીનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં વર્તમાન અને ભાવિ બાંધકામ સાથેનો જમીન વિસ્તાર માપન : 62.70 ચોરસ મીટર વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે ત્યાં, અને તેની સરહદોઃ અને પર બંધાયેલ, **પૂર્વથી** : રઘુભાઈ અંબારામ નેયીનું ઘર, **પશ્ચિમ દ્વારાઃ** ખુલ્લી જગ્યા, **ઉત્તરથી**ઃ ડાહ્યાભાઈ નથીનું ઘર, **દક્ષિણ દ્વારા**ઃ મંગળદાસ નથીનું ઘર અને તેમાં વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે બંધાયેલ છે.

9.	શ્રી/શ્રીમતી કમલેશ જેસંગભાઈ જુડાલ, શ્રી/શ્રીમતી પાયલબેન કમલેશકુમાર ચીધરી લોન એકાઉન્ટ નં. 1866000019238 માંગણા નોટિસ તારીખ 26/02/2024	17/08/2024 સકિતિક કબજો	રૂ. 212813/- (રૂપિયા બે લાખ બાર હજાર આઠસો તેર માત્ર) તા.21 ફેબ્રુવારી 2024 મુજબ સુધીના
----	---	---------------------------	---

સ્થાવર મિલકતનું વિવરણ : દરેક ભાગો અને વિભાગોની સ્થાવર મિલકત, જૂના ગામતલમાં બેટિંગ પ્રોપર્ટી નંબર-439 અને 440 કુલ 125.46 ચો. પિંપળી, તા પાલનપુર જિલ્લી-બનાસકાંઠા, રાજ્ય ગુજરાત રજિસ્ટ્રાર જિલ્લો-પાલનપુરનો પેટા જિલ્લો પૂર્વથી પશ્ચિમની લંબાઈ માપતો: 45-00 ફિટ. અને ઉત્તરથી દક્ષિણ 30-00 ફિટ. વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે કુલ 1350-00 ચો. અને પર બંધાયેલ, પૂર્વ દિશામાં : રામાપીરનું મંદિર આવેલું છે, પશ્ચિમમાં : રોડ સ્થિત છે ઉત્તરથી : જુડલ ભીખાભાઈ ગોદાદાભાઈનું ઘર આવેલું છે, દક્ષિણે : જુદલ ભીખીએન જેસંગભીનો પ્લોટ આવેલો છે અને તેમાં વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે

ı		1-1-01		
	10.	શ્રી/શ્રીમતી ચમાર પ્રહલદભાઈ ગફરભાઈ, શ્રી/શ્રીમતી મોતીબેન પ્રહલદભાઈ ચમાર લોન એકાઉન્ટ નં. 18660000107952 માંગણા નોટિસ તારીખ 26/02/2024	17/08/2024 સાંકેતિક કબજો	રૂ. 318250/- (રૂપિયા ત્રણ લાખ અઢાર હજાર બસો પચાસ માત્ર) તા.21 ફેબ્રુવારી 2024 મુજબ સુધીના

**રવાવર પ્રિલકતનું વિવરણ :** દરેક ભાગો અને વિભાગોની સ્થાવર મિલકત, બેરિંગ એસેસમેન્ટ ક્રમ નં.186, મિલકત નં. 151, સ્થિત મુ.-રણેલા, તા-બેચરાજ્ જિલ્લો-મહેસાણાં. નોંધણી પેટા-જિલ્લો બેચરાજી અને જિલ્લો -મહેસાણા પૂર્વથી પશ્ચિમનું માપનઃ 35 (ચો.ફૂટ) અને ઉત્તરથી દક્ષિણ; 13 (Sq.ft) સંપૂર્ણપણ 42.27 Sq.Mtrs. વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે, અને આના દ્વારા બંધાયેલઃ. અને પર બંધાયેલ, **પૂર્વથી** : પરમાર કાનાભાઈ જેઠાભાઈનું ઘર, **વેસ્ટમાં** પરમાર ઘેમરભાઈ ખુશાલભાઈનું ઘર, **ઉત્તરથી** : પરમાર ધનાભાઈ રેવાભાઈનું ઘર, **દક્ષિણથી** : પરમાર શંભુભાઈ કુબેરભાઈનું ઘર અને તેમાં વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે બંધાર્યેલ છે.

11.	શ્રી/શ્રીમતી વર્ધાજી વિરાજી રબારી, શ્રી/શ્રીમતી કકલબેન વરદાહજી ઘોઘોલ લોન એકાઉન્ટ નં. 19660000245159 માંગણા નોટિસ તારીખ 26/02/2024	17/08/2024 સકિતિક કબજો	ફે. 433792/- (રૂપિયા ચાર લાખ તેનીસ હજાર સાતસો બાર્ણુ માત્ર) તા.21 ફેબ્રુવારી 2024 મુજબ સુધીના
-----	--	---------------------------	--

**સ્થાવર મિલકતનું વિવરણ** : દરેક ભાગો અને વિભાગોની સ્થાવર મિલકત, ગ્રામ પંચાયત મિલકત નં-772/2, રાણપુર (આથમનો વાસ), તા; ડીસા જિલ્લો બનાસકાંઠા, રાજ્ય ગુજરાત નોંઘણી જિલ્લો-પેટા-જિલ્લા-ડીસા મેઝરિંગ, નેંધના સીમમાં આવેલી જૂની ગામતળ કુલ 83.64 ચીરસ મીટરમાં આવેલી મિલકત પશ્ચિમ: 20-00 ફિટ. અને પહોળાઈ ઉત્તરથી દક્ષિણ; 45-00 ફિટ. વર્તમાન અને ભાવિ બાધકામ સાથે કુલ 900-00 ચો.ફૂટ માપન, અને આના દ્વારા સીમિતઃ. અને પર બંધાયેલ, **ઇસ્ટમાં** ઃ રોડ સ્થિત છે, **પશ્ચિમમાં** ઃ રોડ સ્થિત છે, **ઉત્તરમાં** ઃ રબારી બાલ્કા કેશાનું ઘર આવેલું છે, **દક્ષિણમાં** ઃ રબારી વિરાભાઇનું ઘર આવેલું છે અને તેમાં વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે બંધાયેલ છે.

12.	શ્રી/શ્રીમતી ઠાકોર કાળુજી વજાજી, શ્રી/શ્રીમતી ઠાકોર તેજલબેન કાળુજી લોન એકાઉન્ટ નં. 19660000385915 માંગણા નોટિસ તારીખ 26/02/2024	16/08/2024 સાંકેતિક કબજો	રૂ.108207/- (રૂપિયા એક લાખ આઠ હજાર બસો સાત માત્ર) તા.21 ફેબ્રુવારી 2024 મુજબ સુધીના

**રથાવર મિલકતનું વિવરણ** : દરેક ભાગો અને વિભાગોની સ્થાવર મિલકત, મિલકત નંબર-1399, ગ્રામ પંચાયત નંબર 1409 અમરાપુર વિસ્તાર, જે ખારો. સિમમાં આવેલું <mark>છે</mark>, તા-વીરપુર જિલ્લો-મહેસાણા પૂર્વથી પશ્ચિમનું માપનઃ 15.00 ચો.ફૂટ અને ઉત્તરથી દક્ષિણઃ 35.00 ચો.ફૂટ કુલ S5200 માપ. .ft વર્તમાન્ અને ભાવિ બાયકામ સાથે ત્યાં, અને બાઉન્ડેડઃ. અને પર બધાયેલ, **ઇસ્ટમાં :** રોડ, **વેસ્ટમાં** : રોડ, **ઉત્તરથી** : સેંધાજી તલજી ઠાકોરની મિલકત, **સાઉથમાં** ભલાજી વલાજુ ઠાકોરની મિલકત અને તેમાં વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે બંધાયેલ છે.

	-		
13.	શ્રી/શ્રીમતી ગોવિંદજી સેંધાજી ઠાકોર, શ્રી/શ્રીમતી પારુબેન ગોવિંદજી ઠાકોર, સેંધાજી બાબુજી ઠાકોર લોન એકાઉન્ટ નં. 18660000124439 અને 21660000451283 પ્રાંગાગા નેકિંગ નાકીય 26/02/2024	16/08/2024 સકિતિક કબજો	રૂ. 142807/- (રૂપિયા એક લાખ બેતાલીસ હજાર આઠસો સાત માત્ર) તા21 કેબ્રવારી 2024 મજબ સધીના

**રથાવર મિલકતનું વિવરણ :** દરેક ભાગો અને વિભાગોની રથાવર મિલકત, મિલકત બેરિંગ એસેસમેન્ટ ક્રમ નંબર-1/9, મિલકત નં-1/9, સ્થિત મુટ-ચાલુવા તા-જિ-મહેસાણાઁ. નોંધણી પેટા-જિલ્લો-મહેસાણા પૂર્વથી પશ્ચિમ માપનઃ 15 ( Sq.Ft) અને ઉત્તરથી દક્ષિણ; 30 (Sq.ft) ટોટલી મેઝરિંગ 41.81 Sq.mtrs વર્તમાન અને ભવિષ્યના બાંધકામની સાથે, આના દ્વારા બાઉન્ડેડઃ અને પર બંધાયેલ, **પૂર્વથી**ઃ ઠાકોર રહ્યુજી કારખાજીની મિલકત, **પશ્ચિમમાં** ઃ આંતરિક માર્ગ **ઉત્તરથી**ઃ ઠાકોર રમેશજી વેલાજીનું ઘર, **સાઉથમાં** ઃ ઓપન પ્લોટ અને તેમાં વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે બંધાયેલ છે.

	14.	શ્રી/શ્રીમતી મહેન્દ્રભાઈ ઇશ્વરભાઈ પરમાર, શ્રી/શ્રીમતી જ્યાબેન મહેન્દ્રભાઈ પરમાર લોન એકાઉન્ટ નં. 1866000093446 અને 21660000399361 માંગણા નોટિસ તારીખ 26/02/2024	17/08/2024 સકિતિક કબજો	રૂ. 243687/- (રૂપિયા બે લાખ તૈતાલીસ હજાર છસો સત્યાસી માત્ર) તા.21 ફેબ્રુવારી 2024 મુજબ સુધીના
- 1	l			

**શ્વાવર મિલકતનું વિવરણ :** દરેક ભાગો અને વિભાગોની સ્થાવર મિલકત, મિલકત બેરિંગ મિલકત નં-6/89, ગ્રામ પંચાયત ક્રમ નં. 1076, ઇન્દ્રનગર, આટ પાલજ, તા-જી-માંહેસાણા. નોંધણી સબ-જિલ્લા. મહેસાણા પૂર્વથી પશ્ચિમ માપનઃ ( Sq.ft) અને ઉત્તરથી દક્ષિણ; ( Sq.ft) કુલ 97.55 Sq.Mtrs. વર્તમાન અને ભાવિ બાંધકામની સાથે ત્યાં, અને બાઉન્ડેડ ઓનઃ. અને પર બંધાયેલ, **ઇસ્ટમાં**ઃ બલોલનો રોડ, **પશ્ચિમમાં**ઃ સરકારી જમીન, **ઉત્તર દ્વારા**ઃ ફાર્મ, **દક્ષિણ દ્વારા** : ફાર્મ અને તેમાં વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે બંધાયેલ છે.

	લોન એકાઉન્ટ નં. 19660000228242 માંગણા નોટિસ તારીખ 20/05/2024	સાંકતિક કબજાં	આગણચાલાસ માત્ર) તા.14 મે 2024 મુજબ સુધીના
	ાર <mark>પ્રિલકતનું વિવરણ :</mark> દરેક ભાગો અને વિભાગોની સ્થાવર મિલકત, બેરિં ૫ શ્રિય તા-વિગનગર જિલ્લો–મહેસાણા શ્રિત કે પ્રવેશી પ્રશિયન પ્રાપન :		

શ્રી/શ્રીમતી ચૌધરી કલ્પેશકુમાર સાગરરામભાઈ, શ્રી/શ્રીમતી ચૌધરી કુંતલબેન કલ્પેશભાઈ, ચૌધરી સગરામભાઈ દેવજીભાઈ 16/08/2024્

Sq,Ft સાથે વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે ત્યાં, અને બાઉન્ડેડ ઓન;. અને પર બંધાયેલ, **પૂર્વથી** : ચૌધરી શંકરભાઈ દેવજીભાઈનું ઘર, **વેસ્ટમાં** : રોડ **ઉત્તરથીઃ** ચૌધરી રૂઘનાથભાઈ મેઘજીભાઈનું ઘર, **દક્ષિણ દ્વારાઃ** ચુધરી રઘુભાઈ આહલજભાઈનું ઘર અને તેમાં વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે બંધાયેલ છે.

શ્રી/શ્રીમતી શ્રી ચૌધરી નિલેશકુમાર શંકરભાઈ, શ્રી/શ્રીમતી ચૌધરી જીજ્ઞાબેન નિલેશકુમાર, ચૌધરી શંકરભાઈ ડુંગરભાઈ લોન એકાઉન્ટ નં. 1966000077675 માંગણા નોટિસ તારીખ 26-02-2024

રૂ. 255241/-(રૂપિયા બે લાખ પંચાવન હજાર બસો 16/08/2024 એકતાલીસ માત્ર) સાંકેતિક કબજો તા.21 ફેબ્રુવારી 2024 મુજબ સુધીના

**રવાવર મિલકતનું વિવરણ** : દરેક ભાગો અને વિભાગોની સ્થાવર મિલકત, બેરિંગ પ્રોપર્ટી નંબર-249, ક્રમ નં. 292, મુ-રંદાલા તા-વિસનગર જિલ્લો-મહેસાણા લ્લો. વિસનગર અને જિલ્લો-મહેસાણા પૂર્વથી પશ્ચિમ માપનઃ 30.00 (Sq.ft) અને ઉત્તરથી દક્ષિણ; 15.00 (Sq.ft) સંપૂર્ણ રીતે 450.00 Sq.Ft માપવા સાથે ત્યા વર્તમાન અને ભાવિ બાધકામ સાથે,. અને પર બંધાયેલ, **ઇસ્ટમાં** : રોડ, **વેસ્ટમાં** : સેનમા મંગાભાઈનું ઘર, **ઉત્તરથી** : જોતાભાઈ બેચરભાઈનું ઘર, **દક્ષિણ દ્વારાઃ** ચૌધરી જયંતિભાઈનરસંગભાઈનું ઘર અને તેમાં વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે બંધાયેલ છે.

શ્રી/શ્રીમતી દશરથપુરી શામલપુરી ગૌસ્વામી, શ્રી/શ્રીમતી ગૌસ્વામી હેમીબેન દશરથપુરી લોન એકાઉન્ટ નં. 19660000146996 માંગણા નોટિસ તારીખ 28-11-2023	17/08/2024 સાંકેતિક કબજો	રૂ.109255/- (રૂપિયા એક લાખ નવ હજાર બસો પંચાવન માત્ર) તા.21 નવેમ્બર 2023 મુજબ સુધીના
---	-----------------------------	--

**સ્થાવર મિલકતનું વિવરણ** : દરેક ભાગો અને વિભાગોની સ્થાવર મિલકત, પાલનપુર ગામનું રહેદાણ હોવાથી રહેણાંક મિલકત બ્લોક નં-180/2, બી, પ્લોટ નં-120. ધેલાણા ગ્રામ પંચાયત મિલકત નં.573.3 નવા ગામતળ-પાલનપુર જિલ્લો-બનાસકાંઠા રાજ્ય-ગુજરાતમાં કુલ 55-74-20 ચી.મી. 600.00 ચો.ફિટ્સ. પાલનપુર તાલ-પાલનપુર જિલ્લો-પાલનપુરના સિમમાં સિક્યોર એસેટનું કુલ માપ 600.00 ચોરસ ફૂટ સાથે વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે, આના પર સીમિત: **પૂર્વમાં** : 03-00 ફીટ્સ નાવોલી અને ખુલ્લી જમીન આવેલી છે, **પશ્ચિમમાં** : 9-14 મીટર પહોંળો રોડ આવેલો છે, **ઉત્તરથી** : પ્લોટ નંબર-121 આવેલું છે, **સાઉથમાં** : 7-62 મીટર પહોળો રોડ પછી પ્લોટ નંબર-119 આવેલું છે અને તેમાં વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે બંધાયેલ છે.

ક <b>વના</b> : 7-62 નાટર પહાળા શેડ પછા વ્યાટ નખર-119 આપનુ છે અને તેના પતાનાને અને ભારિ આપડાને સાથે ખેવાવને છે.			
શ્રી/શ્રીમતી નથાજી બેચરજી મકવાણા, શ્રી/શ્રીમતી ગાજીબેન નાથાજી મકવાણા લોન એકાઉન્ટ નં. 19660000410889 માંગણા નોટિસ તારીખ 28-11-2023	17/08/2024 સકિતિક કબજો	રૂ. 226290/- (રૂપિયા બે લાખ છવીસ હજાર બસો નેવું માત્ર) તા.21 નવેમ્બર 2023 મુજબ સુધીના	
And a farmer of a court of the			

**રવાવર મિલકતનું વિવરણ :** દરેક ભાગો અને વિભાગોની સ્થાવર મિલકત, તે તમામ સ્થાવર મિલકતના ટુકડા અને પાર્સલ મિલકત સ્થળ કતપુર મિલકત ને. 81 કતપુર ખાતે આવેલી લીમલા ગ્રુપ ગ્રામ પંચાયતની હદમાં, તા. પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે સંપૂર્ણ રીતે 55x15 ચો.ફ્રૂટનું માપ્<sup>ત</sup>, અને તેના પર બંધાયેલ છે. અને તેના પર સીમિત, **પૂર્વથી** : રોડ સ્થિત છે, **પશ્ચિમથી** : ખુલ્લી જમીન આવેલું છે, **ઉત્તરથી** : મેકવાણા વિજયભાઈનું ઘર આવેલું છે, **દક્ષિણથી** : રોડ તેમાં વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે આવેલું છે.અને તેમાં વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે બંધાયેલ છે.

	-argo, adoption do transfer transfer a range and range.				
19.	શ્રી/શ્રીમતી સોનુબેન મહેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી/શ્રીમતી મહેન્દ્રસિંહ ભવરસિંહ ચૌહાણ લોન એકાઉન્ટ નં. 22630000052122 માંગણા નોટિસ તારીખ 28-11-2023	17/08/2024 સકિતિક કબજો	રૂ.2362437/- (રૂપિયા ત્રેવીસ લાખ બાંસઠ હજાર ચારસો સાડત્રીસ માત્ર) તા.21 નવેમ્બર 2023 મુજબ સુધીના		
<b>ભાવર મિલકતનં વિવસ્ત્ર</b> ા દરેક ભાગો અને વિભાગોની સ્થાવર મિલકત. ક્લેટ નં–E–07 ધરાવતો. બ્લોક નંબર-E માં બીજા માળે (મંજર પ્લાન બ્લેક નંબર <i>દ</i>					

મુજબ), લગભગ 134 ચોરસ યાર્ડનું માપન, એટલે કે 112.04 ચો મીટર. સુપર બિલ્ટ-અપ એરિયા અને અવિભાજિત શેર સાથે 42.51 ચો.મી. સેડ સેમની જમીનમાં, "બિનાલી દુકાનો અને રહેદાણ" તરીકે ઓળખાતી યોજનામાં બ્લોક/સર્વે નંબર 665 પાઈકી 4 ના ખાટા નં. 2670 ની જમીન પર સ્થિત છે, જેનું માપન 0-88-33 છે. છે .Sq.Mts. બિન-ખેતીની જમીન, મોજે ગામની સિમમાંઃ કાથલાલ તાલુકોઃ કાથલાલ જિલ્લો-ખેડા જિલ્લામાં અને ખેડાનો નોંધણી પેટા જિલ્લો અને કાથલાલનો નોંધણી પેટા જિલ્લો પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ માપે છે: લગભગ 134 જેટલા માપન ચો.ચાર્ડ્સ, એટલે કે 112.04 ચો.મી. સુપર બિલ્ટ અપ એરિયા અને સેઇડ સ્કીમની જમીનમાં અવિભાજિત હિસ્સાની સાથે સાથે ત્યાં વર્તમાન અને ભાવિ બાંધકામ, અને આના દ્વારા સીમિતઃ. અને પર બંધાયેલ **ઇસ્ટમાં** : ફ્લેટ નંબર-ઇ-6, **વેસ્ટમાં** : ફ્લેટ નં.E-8, **નોર્થમાં** : સાઇડ વે અને બ્લોક-ડી પાછળ, **સાઉથમાં** : બ્લોક-ઇ અને એકુ વચ્ચેનો રસ્તો અને તેમાં વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે બંધાયેલ છે

|--|

**રથાવર મિલકતનું વિવરણ :** દરેક ભાગો અને વિભાગોની સ્થાવર મિલકત, બેરિંગ નં કરણપુર, તા. ભિલોડા જિલ્લો-અસ્વલ્લી બેરિંગ ગ્રામપંચાયત મિલકત નં-283 પૂર્વથી પશ્ચિમ માપતી ભેટાલી જૂથ ગ્રામ પંચાયત: 20 અને ઉત્તરથી દક્ષિણ: 45 કુલ 83.64 ચોરસ મીટર માપન વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે. :. અને પર બંધાયેલ, **પૂર્વથી :** પગી સોમાભાઈ ધુળાભાઈનું ઘર, **પશ્ચિમ દ્વારા**: R.C.C. રોડ, **ઉત્તરથી** : પગી મોતીભાઈ મોહનભાઈનું ઘર, **દક્ષિણ દ્વારા**: ખુલ્લી જમીન અને તેમાં વર્તમાંન અને ભાવિ બાંધકામ સાથે બંધાયેલ છે.

	21.	શ્રા/શ્રીમતી ભાવશકુમાર મફાભાઈ દેસાઈ, શ્રી/શ્રીમતી જડીબેન મફાભાઈ દેસાઈ લોન એકાઉન્ટ નં. 19660000224979 માંગણા નોટિસ તારીખ 28-11-2023	17/08/2024 સાંકેતિક કબજો	રૂ. 266940/- (રૂપિયા બે લાખ છાસાઠ હજાર નવસો ચાલીસ માત્ર) તા.21 નવેમ્બર 2023 મુજબ સુધીના
I	<b>5611</b> d	<b>ાર મિલકતને વિવસ્થા :</b> દરેક ભાગો અને વિભાગોની સ્થાવર મિલકત.	સાઈટ લાલાની મવા	ડી મિલકત ને 104 લાલાની મવાડી ગ્રંપ ગામ પંચાયત

**રથાવર ામલકતનું ાવવરણ** : દરક ભાગા અને ાવભાગાના સ્થાવર ામલકત, સાઇટ લાલાના મુવાડા ામલકત ન.104 લાલાના મુવાડા ગ્રુપ ગ્રામ પચાયત, તા.તલોદ, જિ.સાબરકાંઠાની હદમાં આવેલ લાલાની મુવાડી ખાતે આવેલી છે. અને તેના પર બાઉન્ડેડઃ વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે 63 x 18 ચોરસ ફૂટનું સંપૂર્ણ માપન, અને પર બંધાયેલ, **પૂર્વે** : ફાર્મિસ આવેલું છે, **વેસ્ટમાં :** રો. આવેલું છે, **ઉત્તરથી** : ભાવેશભાઈની પ્લોટ આવેલો છે, **દક્ષિણમાં** : અજમલભાઈ દેસાઈનું ઘર આવેલું છે અને તેમાં વર્તમાન અને ભાવિ બાંધકામ સાથે બંધાયેલ છે.

સહી/- અધિકૃત અધિકારી તારીખઃ 21/08/2024 એયુ સ્મોલ ફાયનાન્સ બેન્ક લિમિટેડ વતી સ્થળઃ ગુજરાત

### **RESTILE CERAMICS LIMITED**

(CIN: - L26931GJ1986PLC102350) Registered Address: 204, Sakar Complex, Opp. Abs Tower, Vaccine Crossing, Old Padra Road, Vadodara, Gujarat 390015; Corporate Address: 2B, Devadaya Apartments, #67, Gandhi Nagar, 1st Main Road, Adyar, Chennai Tamil Nadu 600020;

Email: restile@accountscare.com; Website: www.restile.com

### NOTICE OF 38TH ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION AND BOOK CLOSURE

In continuation of our newspaper notice published on Saturday, August 17, 2024, NOTICE is hereby given that the 38th Annual General Meeting ('AGM/ the Meeting') of the Members of RESTILE CERAMICS LIMITED ('the Company') will be held on Thursday, September 12, 2024 at 12:00 Noon (IST) through Video Conferencing ('VC')/ Other Audio Visual Means ('OVAM'), to transact the business as stated in the AGM Notice, in compliance with the applicable provisions of the Companies Act, 2013 ("the Act") and the rules made thereunder and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations"), read with Circular No. 14/2020 dated April 08, 2020, Circular No. 17/2020 dated April 13, 2020 issued by the Ministry of Corporate Affairs followed by Circular No. 20/2020 dated May 05, 2020, Circular No. 02/2021 dated January 13, 2021, Circular No. 21/2021 dated December 14, 2021, Circular No. 02/2022 dated May 05, 2022 and Circular No. 10/2022 dated December 28, 2022 (collectively referred to as 'MCA Circulars'), and Securities and Exchange Board of India vide its Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020, SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11, dated January 15, 2021, SEBI/HO/CFD/ CMD2/CIR/P/2022/62, dated May 13, 2022 and SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 05, 2023 (collectively referred to as "SEBI Circulars") and all other relevant circulars issued from time to time and all other relevant circulars issued from time to time, without the physical presence of the Members at a common venue.

The Annual Report of the Company including AGM Notice for the financial year ended March 31 2024 ("Annual Report") were sent through electronic mode only to all those members whose email id's are registered with Company or its Registrar and Transfer Agent or the Depositories, in accordance with the MCA circulars and the SEBI circulars and the same has been completed on Monday, August 19, 2024. Members can join and participate in the AGM through VC/ OAVM facility only. The instructions for joining the AGM and the manner of participation in the remote electronic voting or casting vote through the e-voting system during the AGM are provided in the Notice of the AGM. Members participating through the VC/OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Act. The Annual Report is also available on the Company's website at https://www.restile.com/investor-corner/ and on the website of the Stock Exchange i.e. BSE Limited's website at www.bseindia.com and on the website of Central Depository Services (India) Limited ("CDSL") at www.cdslindia.com (agency for providing the e-Voting facility) Members holding shares in physical mode and/ or who have not registered/updated their email address with the Company/ its Registrar and Transfer Agent/ the Depositories and/ or who has acquired shares and become member of the Company after the dispatch of notice and holding shares as of the cut-off date i.e. September 05, 2024 can obtain Annual Report from website of Company/ Stock Exchange/ CDSL and/or login details for joining the AGM through VC/OAVM facility including e-voting by sending scanned copy of: a) Copy of the signed request letter mentioning the folio number/ DP ld and Client ld , name and address of the member; b) Self – attested copy of PAN Card; and c) Self-attested copy address proof (Eg: Aadhar, Driving license, Election Identity Card, Passport) of the member by email to cs@restile.com and cameo@cameoindia.com.

NOTICE is also hereby given that pursuant to the provisions of Section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended, and Regulation 44 of SEBI Listing Regulations, the Company is providing a facility to the members to cast their votes electronically on all the resolutions set forth in the Notice convening the said meeting ("e-voting"). The Company has availed the services of CDSL to provide the facility of remote e-voting /e-voting at the AGM. Members whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting in the meeting. The voting rights of Members shall be in proportion to their shares in paid up equity capital of the Company as on cut-off date i.e.

The Remote e-voting shall commence on September 09, 2024 at 10:00 A.M. (IST) and ends on September 11, 2024 at 05:00 P.M. (IST). During this period shareholders of the Company, holding shares either in physical form or in dematerialised form, as on the cut – off date i.e. September 05, 2024 may cast their vote electronically. The remote e-voting module shall be disabled by the CDSL for voting thereafter. The facility of e-voting will also be made available at the AGM. Only those members attending the AGM through VC/OAVM, who have not cast their vote by remote e-voting and are otherwise not barred from doing so, will be able to vote at the AGM. A member may participate in the general meeting even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to e-vote again in the meeting.

Any person, who acquires shares of the Company and becomes a member of the Company after dispatch of the AGM Notice and holding shares as of the cut-off date may obtain login id and password by sending a request at evoting@cdsl.co.in and also refer to the voting instructions on the CDSL website. However, if he/she is already registered with CDSL for remote e-voting then he/ she can use his/her existing User ID and password for casting vote or following the procedure as mentioned in the AGM Notice. Further, any person, who ceases to be the Member of the Company as on the cut-off date and is in receipt of this communication, shall treat the same for information purpose only.

The detailed instructions for joining the AGM through VC/ OAVM and casting the vote through remote e-voting/ e-voting at the AGM is provided in the Notice of the AGM. Members are requested to carefully go through the same. Members, who need assistance and/or having any grievances before or during the AGM regarding e-voting facility and/ or VC/ OAVM facility, can send a request to Rakesh Dalvi, Sr. Manager, (CDSL) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 at helpdesk.evoting@cdslindia.com or call on toll free no.: 1800 21 09911 or email at cs@restile.com. NOTICE is also hereby given that pursuant to section 91 of the Act read with Rules made thereunder, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from September 06, 2024 to September 12, 2024 (both days inclusive) for the purpose of Annual General Meeting

> For and on behalf of the Board of Direcotrs of Restile Ceramics Limited Sd/-

Viren Rathod **Managing Director** DIN: 03407158

## TATA

**TATA** POWER The Tata Power Company Limited
(Mundra Thermal Power Station - UMPP)
Tunda Vandh Road, Tunda Village, Mundra, Kutch, Gujarat
Reg. Office: Bombay House, 24 Homi Modi Street, Mumbai – 400 001

### NOTICE INVITING EXPRESSION OF INTEREST

The Tata Power Company Limited hereby invites Expression of Interest (EOI) from eligiblioidders for the following requirement for 4150 MW UMPP Mundra Thermal Power Station: Supply and service for replacement of aluminium enclosure in panel (Ref.: MTPS25VS783)

(REI: MTPS25VS783)

2. Supply and service for relay retrofitting in MV switchgear feeders (REF: MTPS25VS788)

3. AMC services for EOT, Gantry and Hoists (Ref: MTPS25AD775)

For prequalification requirements, tender fee, bid security etc., please visit Tender section of our website (URL: https://www.tatapower.com/tenders) and refer detailed Tender Notice for subject tender. Eligible bidders willing to participate in this tender may submit their Expression of Interest along with the Tender Fee latest by **02/09/2024.** 

## **BENGAL & ASSAM COMPANY LIMITED**

INFORMATION REGARDING 77TH ANNUAL GENERAL MEETING

- 1. The 77th Annual General Meeting ("AGM") of the Members of BENGAL 8 ASSAM COMPANY LIMITED will be held on Thursday, the 19th September 2024 at 3:00 P.M. Indian Standard Time, through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM"), to transact the businesses as set out in the Notice convening the AGM, in compliance with all the applicable provisions of the Companies Act, 2013 ("the Act") and the Rules made thereunder, Securities and Exchange Board of India (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015 and all the applicable Circulars issued by the Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India. Members attending the AGM through VC/OAVM shall be reckoned for the purpose of quorum under Section 103 of the Act.
- In compliance with the aforesaid circulars, electronic copy of the Notice o AGM and the Financial Statements for the Financial Year 2023-24 along with Board's Report, Auditors' Report and other documents required to be attached thereto (collectively referred as 'Annual Report') will be sen only by e-mail to all the Members of the Company whose e-mail addresse are registered with the Company/Registrar and Share Transfer Agent (RTA) or Depository Participant(s) (DPs). The aforesaid documents will also be available on the website of the Company at www.bengalassam.com, or the website of Stock Exchange at www.bseindia.com and on the website of Central Depository Services (India) Limited at www.evotingindia.com
- The Company is pleased to provide remote e-voting facility to all its Members to cast their votes on all the resolutions set out in the Notice of the AGM Additionally, the Company shall also provide the facility of voting through e-voting system during the AGM. Detailed procedure for remote e-voting before and during the AGM shall form part of the Notice of the AGM.
- In order to receive annual reports, notices and other communications/benefits to the Shareholders in electronic form, we request the Members who have not yet registered their e-mail addresses or bank account details, to registe the same in respect of shares held in physical form by writing to the Company's RTA: Alankit Assignments Limited, Alankit House, 4E/2 Jhandewalan Extension, New Delhi-110055 and in respect of shares held in electronic form through their respective Depository Participants.
  - Members who hold shares in dematerialized form and want to provide/change/correct their bank account details should send the same immediately to their concerned Depository Participants. Member are also requested to give the MICR Code of their banks to their concerned Depository Participants. Members holding shares in physical form should inform the Company's RTA of any change in their mandate/ bank details.
- Pursuant to the Finance Act, 2020, dividend income is taxable in the hands of the Members w.e.f. 1<sup>st</sup> April, 2020 and the Company is required to deduct tax at source ("TDS") at the prescribed rates from dividend paid to the Members. The prescribed rates would vary depending upon the residential status of the Shareholders and documents registered with the Company The Members are requested to update their PAN with the Depository Participants, if shares held in electronic form and with the Company/RTA if shares held in physical form.

For Bengal & Assam Company Limited Dillip Kumar Swain

Date: 20<sup>th</sup> August, 2024 Place: New Delhi Regd. Off.: 7, Council House Street, Kolkata - 700 001, West Bengal Tel.: 033-22486181, Fax: 033-22481641, Email: dswain@jkmail.com CIN: L67120WB1947PLC221402, Website: www.bengalassam.com

## ઇલેક્ટ્રોથર્મ (ઇન્ડિયા) લિ. રજિસ્ટર્ડ ઓફિસ : એ-૧, સ્કાયલાર્ક એપાર્ટમેન્ટ, સેટેલાઇટ રોડ, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫ CIN: L29249GJ1986PLC009126| ઇ-મેઇલ : sec@electrotherm.com

वेजसाधरः www.electrotherm.com | कोनः +eq-७e-२५७५८८४४ | क्रेड्सः +eq-७e-२५७५८८५५५

#### ૩૮મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ આથી નોટિસ આપવામાં આવે છે કે ઇલેક્ટ્રોથર્મ (ઇન્ડિયા) લિમિટેડ ના શેરધારકોની

ગાયા ત્યારસ બાયવાના બાય છે કે ઇંડાઝૂરોપમ (ઇંડિયા) સ્તિમટડ તા સરસરકાય ૩૮મી વાર્ષિક સાધારણ સભા ("એજીએમ") ગુરૂવાર, ૧૨મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સવારનાં ૧૧.૦૦ વાગ્યે વીડિયો કોન્ફરસ્ત્રિંગ ("વીસી") / અન્ય ઓડીયો વિઝૂયુઅલ માધ્યમ ("ઓએવીએમ") મારફત, ૩૮મી એજીએમ ની નોટીસમાં દર્શાવ્યા મુજબના કામકાજ હાથ ધરવા માટે, યોજવામાં આવશે. કંપની ધારો, ૨૦૧૩ ની લાગુ જોગવાઈઓ અનુસાર, સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ

એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫, કોર્પોરેટ બાબતોના મંત્રાલયના પરિપત્ર નં.૧૪/૨૦૨૦ અને ૧૭/૨૦૨૦ તારીખ ૮મી એપ્રિલ, ૨૦૨૦ અને ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ અને પરિપત્ર ૨૦/૨૦૨૦, ૦૨/૨૦૨૧, ૧૯/૨૦૨૧, ૨૧/૨૦૨૧, ૦૨/૨૦૨૨, ૧૦/૨૦૨૨ અને ૦૯/૨૦૨૩ તારીખ પમી મે, ૨૦૨૦, ા ૩મી જાન્યુઆરી, ૨૦૨૧, ૮મી ડિસેમ્બર, ૨૦૨૧, ૧૪ મી ડિસેમ્બર, ૨૦૨૧, ામી મે, ૨૦૨૨, ૨૮મી ડિસેમ્બર, ૨૦૨૨ અને ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૩ અનુક્રમે 'એમસીએ પરિપત્રો') અને સેબી પરિપત્ર નં.SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/167 . તારીખ ૦૭મી ઑક્ટોબર, ૨૦૨૩ (સેબી પરિપત્ર), ૩૧મી માર્ચ, ૨૦૨૪ ના રોજ પુરા થયેલા નાણાકીય વર્ષ માટે કંપનીના વાર્ષિક અહેવાલ સાથે એજીએમની નોટીસ ... તમામ સભ્યોને મોકલવામાં આવી છે કે જેમના ઈ-મેઇલ કંપની / ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ (ડીપી) / રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ (આરટીએ) સાથે નોંધાયેલા છે. વાર્ષિક અંહેવાલ સાથે એજીએમની નોેટિસની નકલ (i) કંપનીની વેબસાઇટ vww.electrotherm.com પર, (ii) બીએસઈ લિમિટેડ (બીએસઈ)ની વેબસાઈટ <u>www.bseindia.com</u> અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા પર ઉપલબ્ધ છે. <u>vww.nseindia.com</u> અને <u>(iii)</u> સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ) <u>www.evotingindia.com</u> પર પણ ઉપલબ્ધ છે. સભ્યો માત્ર ત્રીસી/ઓએવીએમ <mark>મારફતે એજીએમમાં હાજરી આપી શકે છે અને ભાગ લઈ શકે છે.</mark>

કંપની ધારો, ૨૦૧૩ની કલમ ૧૦૮ને સમયાનુસાર સુધારેલ, કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ બેડમિનિસ્ટ્રેશન) નિયમો ૨૦૧૪નો નિયમ ૨૦ સાથે વાંચતા અને સેબી (લિસ્ટિંગ બોબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ ૨૦૧૫ ના રેગ્યુલેશન ૪૪નું પાલન કરીને એમસીએ પરિપત્રોની સાથે વાંચતા, કેંપની તેનાં સભ્યોને એજીએમમાં પ્રસ્તાવમા મુકાયેલ ઠરાવો પસાર કરવા માટે તેમનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે ક્ષીડીએસએલ દ્વારા પુરા પડાયેલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક માધ્યમથી રેમોટ ઇ-વોટીંગ અથવા એજીએમ દરમ્યાન ઈ-વોટીંગની સવલત આપેલ છે. વીસી / ખોએવીએમ મારફત એજીએમમાં હાજર રહેવાની વેબસાઇટ <u>www.evotingindia.com</u> છે. સભ્યોનાં મતદાનનો અધિકાર કટ ઓફ ડેટ,એટલે કે ગુરૂવાર, પમી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ ધરાવતા કંપનીના સંપુર્ણ ચુકવેલ ઇક્વિટી શેર દીઠ એક મત મુજબ ન પ્રમાણમાં રહેશે. વીસી / ઓએવીએમ મારફત મીટીંગમાં હાજર રહેવાની અને ડેલેક્ટ્રોનિક માધ્યમથી મતદાન કરવાની વિગતવાર પ્રક્રિયા ૩૮મી એજીએમન<u>ી</u> નોટીસમાં પુરી પાડેલ છે. કંપની ધારો, ૨૦૧૩ ની કલમ ૧૦૩ હેઠળ વીસી / બોએવીએમ મારફત મીટીંગમાં હાજર રહેલ સભ્યોની ગણતરી કોરમમાં કરાશે.

રીમોટ ઈ-વોટીંગનો પ્રારંભ સોમવાર, ૦૯મી સપ્ટેમ્બર, ૨૦૨૪ સવારનાં ૦૯:૦૦ ગુગ્યાથી થશે અને બુધવાર, ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૪ સાંજુના ૦૫.૦૦ વાગ્યે પૂર્ણ થશે. ઉપર દર્શાવેલ તારીખ અને સમય ઉપરાંત રિમોટ ઈ-વોટીંગ કરવા દેવાશે નહી. જે વ્યક્તિનું નામ કટ ઓફ તારીખ એટલે કે ગુરૂવાર, ૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સભ્યોના ાત્રક (રૅજીસ્ટર)માં અથવા બેનિફીશ્યલ ઓનરના પત્રક (રજીસ્ટર)માં હોય તે સભ્યોને ૪ રિમોટ ઈ-વોટીંગ અથવા એજીએમમાં ઈ-વોટીંગની સવલત પ્રાપ્ત કરવા માટે લાયક થશે. જો કોઇ વ્યક્તિ એજીએમની નોટીસ અને વાર્ષિક અહેવાલ રવાના થયા બાદ પરંતુ, કટ

ઓફ ડેટ,એટલે કે ગુરૂવાર, ૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ કે તેના અગાઉ કંપનીના સભ્ય બને તેમણે ઇ-વોટીંગ માટેનાં યુઝર આઇડી અને પાસવર્ડ માટે લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, રજીસ્ટ્રાર એન્ડ શેર ટ્રાન્સફર એજન્ટ (આરટીએ)ને nhmedabad@linkintime.co.in પરે ઇ-મેઇલ લખી વિનંતી કરવી.

બેજીએમ માં હાજર રહેતાં જે સભ્યોએ તેમનો મત રિમોટ ઇ-વોટીંગ મારફત આપેલ નથી તેઓને એજીએમમાં તેમોનો મત આપવાનો અધિકાર રહેશે. જે સભ્યોએ તેમનો મત એજીએમ અગાઉ આપી દીધો હશે તેઓ મીટીંગમાં હાજર રહી શકશે પરંતુ ફરીથી નેમનો મત આપવા માટે હકદાર રહેશે નહીં.

બેજીએમ કે સીડીએસએલ ઈ-વોટિંગ સિસ્ટમ મારફત ઈ-વોટિંગ સંબંધિત કોઈ પ્રશ્નો કે ગુંચવણ હોય તો તેઓએ <u>helpdesk.evoting@cdslindia.com</u> પર ઈ-મેઈલ મોકલવો મથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૨૫૫૩૩૫ર સંપર્ક સાધવો.

ઈલેક્ટ્રોનિક માધ્યમ મારફત વોટિંગ સુવિધા સંબંધિત તમામ ફરિયાદીને શ્રી રાકેશ ડાલ્વી, સિનિયર મેનેજર, સેન્ટ્રલ ડિપોઝિંટરી સર્વિસિઝ (ઈન્ડિયા) લિમિટેડ, એ વિંગ, **૮૫મો માળ, મેરેથોન ફ્યુચરેક્સ ફફ્**યુચરેક્સ, મફતગાલે મીલ કમ્પાઉન્ડ, એન.એમ. જોષી માર્ગ, લોઅર પરેલે (પૂર્વ), મુંબેઈ - ૪૦૦ ૦૧૩ સંબોધિત કરશે તથા ઈમેઈ**લ** helpdesk.evoting@cdslindia.com પર અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૨ ૫૫ ૩૩ પર સંપર્ક સાધવો.

ઇલેક્ટ્રોથર્મ (ઇન્ડિયા) લિમીટેડ વતી

સહી/ ફાગેશકુમાર આર. સોની કંપની સેક્રેટરી

તારીખ : ૨૦મી ઓગસ્ટ, ૨૦૨૪

સ્થળ : પલોડિયા

(મેમ્બરશીપ નં. F૮૨૧૮)